

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૨/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૧૭/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૪ વ્યક્તિઓને ઝડપી, ૯૧ લીટર દેશી દારૂ અને ૦૮ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૨ કેસ કરી ૦૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૦૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૧૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૯૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૧૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

લુંટની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૪૧૯/૧૭

ઓઢવ : પુનમસિંહ મહોબતસિંહ સોલંકી (ઉ.વ.૩૨)(રહે, ગામ: સુરાવત તા.કઠલાલ જી,ખેડા) તા.૧૩/૨/૧૭ સાંજના ૪/૩૦ વાગ્યાના સુમારે સોનીની ચાલી કમલ પેલેસ હોટલ સામે આવેલ રીક્ષા સ્ટેન્ડની પાસે સર્વિસ રોડ ઉપર મો.સા નં.જીજે.-૧-એફ.બી-૯૩૮૧ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો (૩૦ થી ૩૫ વર્ષના આશરાના) પોતે પોલીસમાં હોવાનું જણાવી, પુનમસિંહ સાથે છુટા હાથની મારમારી કરી, તેમના શર્ટ તથા પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૧૫,૫૦૦/- ની લુંટ કરી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ પુનમસિંહ સોલંકીએ તા.૨૭/૨/૧૭ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી દિનેશભાઈ હરજીભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર : વસંતભાઈ પસાભાઈ પરમાર (રહે,વિજય કામદાર સોસાયટી, પ્રભાકર ટેનામેન્ટની બાજુમાં સેજપુરબોધા) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૨/૧૭ ના કલાક ૦૦/૩૦ વાગ્યાનાં સુમારે કૃષ્ણનગર બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડીયાર માતાના મંદીર પાસે તેમજ પાટીયા સર્કલ પાસે મદીના ફાય સેન્ટર નજીક આરોપી રાજા પાપી (રહે,સુમીન પાર્ક સોસાયટી, પ્રભાક ની બાજુમાં સેજપુર) તથા તેના ચાર મીત્રો (જેના નામ સરનામાની ખબર નથી) ભેગામળી વસંતભાઈને મુઠ માર મારી તેમનાં ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એસ.અસારી ચલાવે છે.

ઓઢવ : સંતોષબહેન વા/ઓ દિલીપભાઈ મહેતા (ઉ.વ.૪૭)(રહે,રાજરત્ન સોસાયટી ગીતા ગૌરી સિનેમા પાસે ઓઢવ) તા.૨૭/૨/૧૭ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે દેવી સાયકલ સ્ટોર પાસે રંગોલી આઈસ્ક્રીમની દુકાન પાસે રોડ ઉપરથી ચાલતાં પસાર થતાં હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષ આશરનાં) સંતોષબહેનનાં ગળામાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- ખેંચી તોડી લઇ ગયા હતા. આ અંગેની ફરીયાદ સંતોષબહેન મહેતાએ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી મુકેશસિંહ જગરૂપસિંહ ચલાવે છે.

એલીસબ્રીજ : અરૂણાબહેન વા/ઓ યોગેશરાય ચૌહાણ (ઉ.વ.૫૯)(રહે,પ્રભા વસંત પેલેસ ચોક, ગણપતીના મંદિર પાસે ભદ્ર કાંરજ) તા.૨૬/૨/૧૭ રાતના ૮/૪૦ થી ૮/૫૦ વાગ્યા દરમ્યાન લકડિયા બ્રિજ ઉપર રોડ ઉપરથી પોતાની સ્કુટી પંપ ચલાવી પસાર થતાં હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ અરૂણાબહેનનાં ગળામાંથી બે સોનાની ચેઇન કુલ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેંચી તોડી લઇ ગયા હતા. આ અંગેની ફરીયાદ અરૂણાબહેન ચૌહાણે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એન.ખોખરા ચલાવે છે.

રામોલ : શકુન્તલાબહેન વા/ઓ રમણલાલ પ્રજાપતી (ઉ.વ.૫૯)(રહે.ગોકુલ નગર અંજલી સ્કુલની સામે સુરેલીયા રોડ વસ્ત્રાલ) તથા સાહેદ લીલાબહેન તા.૨૭/૨/૧૭ બપોરના ૩/૩૦ થી ૩/૪૫ વસ્ત્રાલ વુંદાવન પામના મેઇન ગેટ આગળ આવતા રોડ ઉપર તથા માનસરોવર ૦૧ ના મેઇન ગેટ સામેથી પસાર થતાં હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ શકુન્તલાબહેન અને લીલાબહેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૭,૦૦૦/- અને કિંમત રૂપિયા ૫,૦૦૦/- ખેંચી તોડી લઇ ગયા હતા. આ અંગેની ફરીયાદ શકુન્તલાબહેન પ્રજાપતિએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ડી.સોલંકી ચલાવે છે.

નિકોલ : વનિતાબહેન ચંદુભાઈ કણસાગરા(પટેલ)(ઉ.વ.૩૬)(રહે.મીરા મીલન રેસીડેન્સી પરમેશ્વર બંડ્લોઝ ની સામે, નિકોલ નરોડા રોડ) તા.૨૭/૨/૧૭ ના કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે નિકોલ ગંગોત્રી સર્કલ પાસે નીલકંઠ રેસીડેન્સીની સામે રોડ ઉપરથી પસાર થતાં હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૩૦ થી ૩૫ વર્ષ આશરનાં) વનિતાબહેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેંચી તોડી લઇ ગયા હતા. આ અંગેની ફરીયાદ વનિતાબહેનએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એન.ચાવડા ચલાવે છે.

ચાંદખેડા : (૧) ઈશાંત જીતેન્દ્રકુમાર દવે (ઉ.વ.૩૨)(રહે, નિધી-૧ એપાર્ટમેન્ટ મોટેરા રોડ) એ તા.૨૫/૦૨/૧૭ બપોરના ૨/૦૦ થી તા.૨૭/૦૨/૧૭ ના કલાક ૧/૨૫ વાગ્યા દરમ્યાન કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી ભરતકુમાર મણીલાલ ચલાવે છે.

(૨) સંજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ (ઉ.વ.૨૩)(રહે,લેઉઆ ભાગ, રામજી મંદિર પાસે, ચાંદખેડા ગામ) એ તા.૨૭/૦૨/૧૭ બપોરના ૧/૩૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘરના હુકમાં કમર પટ્ટો ભરાવી, પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી અબ્દુલભાઈ મુસાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.